

સુધારા જાહેરાત (જા. ક. ૯૮/૨૦૧૬૧૭)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૯૮/૨૦૧૬૧૭, વિવિધ ખાતાના વડા હસ્તકની સિનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની તા.૧૩/૦૮/૨૦૧૭ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોનું ભાગ-૧ નું આખરી પરીણામ તા.૨૧/૧૨/૨૦૧૭ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. તેમાં લઘુત્તમ લાયકી ગુણના ધોરણને ધ્યાને લઈ મેરીટના ધોરણે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) માટે લાયક ઠરેલ ઉમેદવારોની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી તા.૨૦/૦૧/૨૦૧૮ અને તા. ૨૧/૦૧/૨૦૧૮ના રોજ યોજવામાં આવનાર છે જેના અભ્યાસક્રમમાં નીચે મુજબનો સુધારો ધ્યાને લેવાનો રહેશે.

ભાગ-૨ કોમ્પ્યુટરપ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી, કુલ ગુણ-૧૦૦, સમય-૧ કલાક ૩૦ મિનિટ

Question. No.	Particulars of Test	Marks
1	Gujarati Typing Test	30 Marks
2	English Typing Test	20 Marks
3	Preparing a note in word file	10 Marks
4	Preparing a Power Point Slide for presentation based on data provided.	15 Marks
5	Preparing an Excel spreadsheet and answering an arithmetic problem.	15 Marks
6	Emails (with attachments)	10 Marks
		Total- 100 Marks

નોંધ :-

Question.No.1:ગુજરાતી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે.

Question. No.2: અંગ્રેજી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે.

Question. No.3:અંગ્રેજી ભાષામાં સોફ્ટ કોપીમાં રહેશે.

Question.No.4 & 5: અંગ્રેજી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે.

Question. No. 6:અંગ્રેજી ભાષામાં હાર્ડ કોપીમાં રહેશે, પરંતુ attachment soft કોપીમાં રહેશે.

(૧) આ કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માઈક્રોસોફ્ટ ઓફીસ ૨૦૦૭ના વર્ઝન (Version)માં લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેન્ગવેજ ઈનપુટ ટુલ-૩ રહેશે. આ સોફ્ટવેરમાં નીચે મુજબના આઠ (૮) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Gujarati Indica

6. Remington Indica
7. Special Characters
8. Gujarati Terafont

- (૨) ગુજરાતી ટાઇપીંગ, અંગ્રેજી ટાઇપીંગ, વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) ની પરીક્ષા સોફ્ટવેર દ્વારા ખોલી આપવામાં આવેલ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) માં જ આપવાની રહેશે. વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) પરીક્ષામાં ઉમેદવારે કોઈ ફાઈલ બનાવવાની રહેશે નહીં. એ ફાઈલ સોફ્ટવેર દ્વારા ઓટોમેટીક બનશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષાના સોફ્ટવેર સિવાય ફાઈલ ઓપન કરી લખશે તો ઉમેદવારનું પરીણામ માન્ય ગણાશે નહીં.
- (૩) ઉમેદવારને કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર મંડળ તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારને પોતાનું કી બોર્ડ લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી શરૂ થતાં પહેલા અને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા બાદ આપને ફાઇલવેલ કોમ્પ્યુટર કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર બરાબર ચાલે છે તેની ખાત્રી કરી લેવાની રહેશે.
- (૪) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી સમયે કોમ્પ્યુટરમાં કોઈ ટેકનીકલ ખામી જણાય તો ઉમેદવારે અન્ય ઉમેદવારને ખલેલ પહોંચાડ્યા વગર તેમજ પોતે કોઈ પગલાંઓ લીધા વગર પોતાનું સ્થાન જાળવી રાખીને (ઉભા થયા વગર) વર્ગ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ને જાણ કરવાની રહેશે.
- (૫) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે એક જ વાર “**Log in**”થઈ શકાશે. પરીક્ષાનો સમય ૧-૩૦ કલાક પૂરો થયા પહેલા ઉમેદવાર પોતે “**Submit**”કરી દેશે. તો ફરીથી “**Log in**”થઈ શકશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો સમય ૧-૩૦ કલાક બાદ સમય પૂર્ણ થવાના કારણે ટાઇપ થવાનું આપોઆપ બંધ થઈ જશે. એ સમય પહેલા જો ઉમેદવાર **Confirm / Accept**કરીને તેમનું ટાઇપ કામ સબમીટ (Submit) કરી દેશે તો તે પછી ટાઇપ કામ થઈ શકશે નહીં.
- (૬) પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક ૧ થી ૬ અંતર્ગત તેના જવાબ માં કરવામાં આવેલ ભૂલો જેવી કે, સ્પેલીંગ / જોડણીની ભૂલ, માર્જિન સેટીંગ, ફોન્ટ સાઇઝ, ટાઇપકામ ની ભૂલ બાબતે માર્કિંગ, મંડળના નિર્ણય અનુસાર કરવામાં આવશે.
- (૭) આખરી પરિણામ, પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ (**Minimum qualifying marks**)નું ધોરણ દરેક કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું નિયત થયેલ છે.
- (૮) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું પરિણામ કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ આધારીત હોઈ, તેના રીચેકીંગ અંગેની અરજી ધ્યાને લેવામાં આવશે નહિં

ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ ઉમેદવારો માટેની સુચનાઓ તથા ઉક્ત પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવશે તેથી મંડળની વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

તા.૦૧/૦૧/૨૦૧૮

સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગાંધીનગર